

: માનસિક સમસ્યાઓની સારવાર :

પ્રશ્ન -૧

શું માનસિક સમસ્યાઓ ફક્ત સલાહ સુચના અને કાઉન્સેલિંગથી નિવારી શકાય ?

ઉત્તર-૧

જ્યારે અમૃક તીવ્રતાના માનસિક લક્ષણો રોજિંદા કામકાજ અને સામાજિક, તથા કૌટુંબિક જીવનમાં સમસ્યા પેદા કરતા હોય ત્યારે તેના માટેની જરૂરી દવાઓ સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે. આ સમસ્યાઓ કાલ્યનિક કે ઉપજાવી કાઢેલી ન હોતા, માત્ર છચ્છવાથી દૂર થઈ જાય એવી નથી હોતી. મહંડ અંશો વ્યક્તિ-અતિશાય માનસિક તાણમાં હોવા છતાં બાહ્ય માનસિક અને શારીરિક સ્વસ્થતા જાળવી રાખી શકે છે અને તેથી જ તેમને બીજાની સહાનુભૂતિ મળતી નથી. જ્યારે તકલીફ વિષે ફરિયાદ કરે ત્યારે સામાન્ય સમજણા પ્રમાણોની સલાહ સુચના મળે છે જે વધુ નુકશાનકર્તા સાબિત થાય છે. (દા.ત. સારા વિચાર(પોઝિટીવ) કર, ખોટી તાણ ઉભી નહીં કર, મનને મજબૂત કર.....વગેરે)

હકીકતમાં અહીં વ્યક્તિને મનોચિકિત્સકની સલાહ અનુસાર દવાઓ અને સારવારની જરૂર હોય છે.

અમૃક સમસ્યાઓ જેવી કે પરસ્પરના સંબંધોમાં સંદર્ભ વ્યવસાયિક મુશ્કેલીઓ, લગ્નસંબંધોમાં તાણા, બાળઉછેર સંબંધી મુશ્કેલીઓ વિગેરે કાઉન્સેલિંગથી ઉકેલી કે હળવી કરી શકાય, પરંતુ અહીં વ્યક્તિએ યોગ્ય તાલીમબદ્ધ કાઉન્સેલરની જ મદદ લેવી જોઈએ.

પ્રશ્ન-૨

મનોચિકિત્સામાં દવાઓની જરૂર કેમ છે ?

ઉત્તર-૨

દવાઓ અમૃક માનસિક રોગોની સારવારમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. માનસિક રોગના લક્ષણો મગાજમાંના રસાયણો-ન્યુરોટ્રાન્સમીટરના અસમતોલપણાથી થાય છે . દવાઓ આ રસાયણોને સમતુલિત કરીને લક્ષણોને ઝડપથી કાબૂમાં લાવી શકે છે. (દા.ત. ડાયબીટીસની દવાઓ લોહીમાંના સાકરના પ્રમાણાને નિયંત્રણાં લાવી દે છે.) આ માનસિક લક્ષણો દરદીના કાબૂ બહારના હોવાથી, દવાઓ દરદીને સાજો કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

પ્રશ્ન-૩

મારા સ્વજનો મને યોગ, જીમ, નૃત્ય કે સંગીતના વર્ગોમાં ભાગ લેવાનું સુચવે છે, જે મારા મનને પ્રકૃતિલિત કરીને મારી માનસિક મુશ્કેલી દૂર કરી શકશો. શું માનસિક બીમારીઓનું નિવારણ જીવન પદ્ધતિ બદલવાથી કે ઇતર પ્રવૃત્તિમાં ભાગ લઈને થઈ શકે છે ?

ઉત્તર-૩

ઉપર્યુક્ત ઘણી પ્રવૃત્તિઓ ખાસ કરીને થોગ અને કસરતો તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. અને એ મહદ અંશો સ્વર્થ જીવન જીવવાની ચાવી છે. પરંતુ એ ચોક્કસ માનસિક બીમારીઓનો ઈલાજ નથી. પ્રત્યેક માનસિક બીમારી માટે તેને જ લગતી દવાઓ અને જરૂરી વિવિધ માનસોપચાર (સાઈકોથેરાપી) આવશ્યક છે.

પ્રશ્ન-૪

ગયા વખતે એને ઉંઘવાની દવાઓ ૩-૪ દિવસ લેવાથી માનસિક લક્ષણો કાબૂમાં આવી ગયાં હતાં. આ વખતે આટલું ઝડપી પરિણામ કેમ નથી મળ્યું?

ઉત્તર -૪

કદાચિત ગયા વખતે એમને આવેલો માનસિક લક્ષણોનો હુમલો એટલો ગંભીર ન હતો. પરંતુ આ વખતે એમ જ હોવું જરૂરી નથી. હકીકતમાં સંશોધનો દ્વારા એ પ્રમાણિત થયું છે કે આવનારો દરેક માનસિક હુમલો છેલ્લા હુમલા કરતા વધુ ગંભીર અને લાંબુ ચાલનારો હોય છે.

પ્રશ્ન-૫

માનસિક સારવાર દવાઓ સહિત કેટલો વખત ચાલુ રાખવી જરૂરી છે ?

ઉત્તર-૫

માનસિક રોગોની સારવાર એમના વિશિષ્ટપણા પર અવલંબે છે. માનસિક સારવાર, વ્યાવસાયિક મનોચિકિત્સકની દેખરેખ નીચે જ ચાલુ રાખવી જરૂરી છે. દવાઓને લગતી અસરો તેમ જ આડ-અસરોની મનોચિકિત્સક સાથે વખતો વખત ચર્ચા આવશ્યક છે. જેથી એને લગતા પ્રશ્નોનું સમાધાન અને આડઅસરોનું નિરાકરણ લાવી શકાય. મનોચિકિત્સામાં દવાઓ મનોચિકિત્સકની સલાહ વિના ઘટાડવી કે બંધ કરવાથી દુષ્કર પરિણામ આવી શકે છે.

પ્રશ્ન-૬

હિતાશા, ચિત્તભ્રમ કે ગાભરામણાની સારવાર માટેની દવાઓની આડઅસરો શું છે ?

ઉત્તર -૬

દરેક જૂથની દવાઓની પોતપોતાની આડઅસર હોઈ શકે છે. પ્રત્યેક દરદીનો આડઅસરનો અનુભવ તેની પોતાની તાસીર પર પણ અવલંબે છે. તમારા મનોચિકિત્સક સાથે એના વિષેની ચર્ચા કરી લેવી જરૂરી છે. સારવાર શરૂ કરતી વખતે તમારા ડોક્ટર તમને એ દવાઓ વિષેની મહત્વની અસરો વિષે જરૂર માહીતગાર કરશો.

પ્રશ્ન-૭

મનોચિકિત્સાની દવાઓથી ખૂબ ઊંઘ આવે એવું માનવું છે. શું એ બધી ઊંઘની ગોળીઓ છે ?

ઉત્તર-૭

મનોચિકિત્સા માટે વપરાતી બધી દવાઓ વધુ પડી ઊંઘ લાવે એ જરૂરી નથી. મોટા ભાગની દવાઓનું બંધારણ એવું હોય કે રોજબરોજની કિંદગીમાં એ ખલેલ પહોંચાડતી નથી સારવારની શરૂઆતમાં અમૃત દરદીઓને થોડી વધુ ઊંઘની સમસ્યા વધારે વખત સતાવે તો એના વિષે પાતાના મનોચિકિત્સક સાથે ચર્ચા કરીને ઉપાય થઈ શકે છે.

‘ઊંઘની ગોળીઓ’ એ મનોચિકિત્સાની દવા માટે દરદી અને સામાન્ય દવાવાળા કારા વપરાતો એક ખોટો શર્દું પ્રયોગ છે.

દવાઓનો મૂળભૂત હેતુ નિદ્રા લાવવાનો નથી પણ મગાજમાં જે રસાયણોનું સંતુલન વિચલિત થયું હોય એને સરખું કરવાનો છે.

પ્રશ્ન -૮

એલોપેથીક દવાઓની આડઅસર એક બહુચર્ચિત વિષય છે.

મનોચિકિત્સાની દવાઓ લાંબો વખત લેવાથી શું લીવર કે કીડનીને નુકશાન થઈ શકે ?

ઉત્તર-૮

માનસિક સારવારની દવાઓ એલોપથીની બીજા રોગોની સારવારની દવાઓની જેમ જ અમૃત આડઅસરો ધરાવે છે. કોઈપણ સારવાર જે મહદ અંશો ગંભીર રોગમાંથી મુક્તિ આપાવતી હોય તો એની થોડી આડઅસરો સ્વીકાર્ય હોવી જોઈએ. આ જ વાત મનોરોગોની સારવાર માટે પણ એટલી જ યથાર્થ છે. મનોચિકિત્સાની દવાઓની આડઅસરનો તો સમાજમાં હાઉં ઉભો કરવામાં આવેલો છે, જે મનોરોગ અને મનોરોગી ઉપર લાગોલા કલંકનો જ એક ભાગ છે.

દરેક જાતના ઔષધોપચારમાં આડઅસર થઈ શકે જે ઔષધના બંધારણ અને દરદીની તાસીર પર છે. મનોચિકિત્સકની દેખરેખ હેઠળ થયેલી સારવારમાં આ શક્યતા ઘટાડી શકાય અથવા સરળ ઉપાય કરી શકાય છે. લાંબા ગાળાની સારવારમાં લીવર કે કીડનીને નુકશાન થવાના કોઈજ તારણ નથી.

પ્રશ્ન-૯

શું એ સાચું છે કે માનસિક સારવાર માટેની દવાઓ દરદીના ફાનંતંતુ તેમજ મગાજની કાર્યશક્તિને નબળા પાડી દે છે ?

ઉત્તર-૮

માનસિક રોગોની દવાઓ વિષે ફેલાવવામાં આવેલી આ એક તદ્દન વાહિયાત માન્યતા છે. ઘણાં દરદીઓ આ દવાઓ તેમના જુવનપર્યત લે છે. લગભગ ૩૦-૪૦ વર્ષ દવા લેનાર દરદીના મગાજમાં પણ કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસરો નોંધવામાં આવી નથી. આ દવાઓ અત્યંત ઊંડા સંશોધન અને પ્રયોગો પછી જ બજારમાં મૂકવામાં આવે છે.

બીજુ કોઈપણ સારવારની જેમ જ, આ દવાઓ પણ મનોચિકિત્સકની સંપૂર્ણ દેખરેખ નીચે જ લેવાવી જોઈએ.

બાળ મનોરોગીઓ માટેની ખાસ ઔષધિઓ પણ આ જ રીતે ઊંડા સંશોધન અને પ્રયોગો પછી તેથાર કરવામાં આવી છે.

પ્રશ્ન-૧૦

હોમિયોપથીક ચિકિત્સા પદ્ધતિની બિલકુલ આડઅસરમુકત સારવારની જાહેરાત અનુસાર શું એ મનોચિકિત્સા માટેના વધુ સારો પર્યાય નથી ?

ઉત્તર-૧૦

દરેક દરદીને એની આસ્થા અને વિશ્વાસ અનુસાર ચિકિત્સા પદ્ધતિ પસંદ કરવાનો અધિકાર છે. પણ એનો આધાર પ્રમાણભૂત હોવો જોઈએ નહિ કે પ્રચાર કે જાહેરાતથી દોરાયેલો જો કોઈપણ સારવાર રોગ નિર્મૂળ કરી શકતી હોય તો સાથે એની થોડી પણ આડઅસર જરૂર હોય જ છે.

એકવાર નિદાન થયા પછી ડીપ્રેશન, મેનીઆ કે સ્કીઝોફેનીઆ જેવી ગંભીર બીમારીના ઇલાજમાં વિલંબ થવો બિલકુલ વ્યાજબી નથી અને એટલે જ એને તરત કાબૂમાં લેવાનું પણ અત્યંત આવશ્યક છે.

દર્દીએ એની પોતાની સારવાર પદ્ધતિના ચિકિત્સક ને એના સારવાર પદ્ધતિ બદલવાના નિર્ણય વિષે વાકેફુ કરવા જરૂરી છે. એ વાત તો ચોક્કસ છે કે મનોચિકિત્સકની સલાહ વિના એલોપથીક દવાઓ ચાલુ રાખવી જોઈએ નહિ.

પ્રશ્ન-૧૧

એલોપથીની દવાઓમાં ‘કેમિકલ’ હોય છે તો પછી નેચરોપથી અથવા હર્બલ દવાઓ વધારે સુરક્ષિત કે નહિ ?

ઉત્તર-૧૧

દરેક ચિકિત્સાપદ્ધતિની દવાઓના બંધારણામાં કેમિકલનું જ માળખું હોય છે ફક્ત તેના સ્પોત જુદા જુદા હોય છે જેમકે હર્બલ (વનસ્પતિજ્ઞ), પ્રાણીજ્ઞય અથવા ફૂંઝિમ. કુદરતી કે ફૂંઝિમ દરેક પદ્ધતિના ફાયદા અને ગોરફાયદા છે.

એલોપેથી દવાઓ આગળ જણાવ્યું એમ વર્ષોના સંશોધન, પ્રયોગો અને અનુભવથી વિશુદ્ધ થઈને ઉપયોગમાં લેવામાં આવે છે. એની પછી પણ આ એમાં સંશોધન થતું રહે છે. માનસિક બીમારીના ઇલાજમાં મહત્વની જરૂરીયાત છે ઝડપી સુધારાની જે એલોપેથી દવાઓમાં શક્ય છે.

પ્રશ્ન-૧૨

ઇ.સી.ટી શું છે. શું એ શોક ટ્રીટમેન્ટ છે? આ સારવાર શું હજુ પણ વપરાશમાં છે?

ઉત્તર -૧૨

ઇલેક્ટ્રો-કન્સ્લસીલ્ફ થેરાપી (ઇ.સી.ટી) ની સારવારમાં વીજળીના હળવા પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ભગાજના ફાનતંત્રાઓમાં થતા રાસાયણિક ફેરફારથી સંતુલન પેદા થાય છે અને માનસિક લક્ષણોમાં ઝડપથી સુધારો થાય છે.

વિદ્યુત પ્રવાહનો ઉપયોગ શરીરના અન્ય ઘણા રોગોની સારવાર માટે થાય છે. માટે જ 'શોક ટ્રીટમેન્ટ' એ ખોટો શાબ્દ પ્રયોગ છે.

ઇ.સી.ટી એક પ્રમાણાભૂત, વૈજ્ઞાનિક ઉપચાર છે. જે ઘણા માનસિક રોગોની સારવાર માટે આખી દુનિયામાં ઘણા વરસોથી વપરાય છે. આ એક અત્યંત અસરદારક અને ઉપયોગી સારવાર પદ્ધતિ છે. ખાસ કરીને અમૃક બીમારીની કટોકટીમાં તે સારામાં સારી ઉપચાર પદ્ધતિ તરીકે પ્રમાણિત છે. કમનસીબે, માનસિક બીમારી પ્રત્યેની લોકોની સૂગ અને 'શોક' ના ડર અને ગેરસમજથી આ સારવાર સ્વીકારતા લોકોને ખચકાટ થાય છે.

પ્રશ્ન-૧૩

ચલચિત્રોમાં ઈસીટી બતાવવામાં આવે છે એ પ્રમાણે શું એ અત્યંત નુકશાનકારક અને પીડાદાયી છે?

ઉત્તર-૧૩

બિલકુલ નહિ, ઈસીટી ચલચિત્રને સનસનાટીપૂર્ણ બનાવવા માટે એ રીતે બતાવવામાં આવે છે, જ્યારે હકીકિત સાવ જુદી જ છે.

મનોરોગીની સારવાર વખતે ઈસીટી આપતા પહેલા દરદીને વ્યાવસાયિક એનેસ્થેટીસ્ટભારા બેછોશ કરીને અને સ્નાગુઓને શિથિલ કરીને પછી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. જેથી દરદીને પીડીરહિત સારવાર મળે છે.

પ્રશ્ન-૧૪

શું દરદીની માનસિક બીમારી એટલી બધી ગંભીર છે કે એને ઇ.સી.ટી. આપવા પડે?

ઉત્તર-૧૪

ઇ.સી.ટી. એક ખૂબજ સુરક્ષિત સારવાર પદ્ધતિ છે એટલે એનો છેલ્લામાં છેલ્લા પર્યાય તરીકે ઉપયોગ કરવાનું જરાપણ યોગ્ય નથી.

જ્યારે દર્દી ખૂબજ આકમક કે હિંસક થઈ ગયો હોય કે પછી તેને સતત આત્મહંત્રા કરી નાંખવાના વિચારો આવતા હોય કે પછી એને મોટા ભાગની દવાઓ અસર કરતી ઓછી થઈ જાય ત્યારે ઇસીટી એને સારો કરવામાં બહુંજ મહત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ન-૧૫

ઇ.સી.ટી. ની આડઅસરો શું છે ? ચલચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઇસીટી આપવાથી સ્વૃતિબંશ કે મગાજને નુકશાન થાય છે ?

ઉત્તર-૧૫

ઇસીટી આખ્યા બાદ દર્દીને થોડું માથુ દુઃખે કે ર્નાયુઅઓ પીડા આપે જે સામાન્ય દરદશામક દવાઓથી શાખી જાય છે. તાત્પુરતો સ્વૃતિબંશ કે ગુંચવણ રહે પણ એકવાર સારવાર પૂરી થઈ જાય પછી એ બધુ પૂર્વવત થઈ જાય છે.

ઇસીટીનું ચલચિત્રોમાં કરવામાં આવતુ ભયજનક ચિત્રણ લોકમાનસમાં ખોટુ ચિત્ર ઉપસાવે છે. સંશોધનો દ્વારા એ પ્રમાણિત થયું છે કે મનોચિકિત્સક દ્વારા પદ્ધતિસર રીતે આપવામાં આવેલા ઇસીટી થી મગાજને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.

પ્રશ્ન-૧૬

એકવાર ઇસીટી સારવાર શરૂ કર્યા પછી શું એ જીવનપર્યત ચાલુ રાખવી પડે છે. ?

ઉત્તર-૧૬

પ્રયોક માનસિક બીમારીનો ઇ.સી.ટી નો કોર્સ જુદો જુદો હોઈ શકે. પરંપરાગત રીતે, દ થી ૧૦ ઇસીટીમાં દર્દીને ભરપૂર સુધારો દેખાય છે. કયારેક અમુક દર્દીઓને થોડા થોડા સમયાંતરે ઇસીટી આપવા પડે છે પણ એ માનવુ ભૂલ ભરેલું છે કે ઇસીટી જીવનપર્યત આપવા પડે.

પ્રશ્ન-૧૭

શું શરીરકીયાથી પણ માનસિક સારવાર શક્ય છે ?

ઉત્તર -૧૭

હા. કેટલાક મનોરોગ જેવા કે ગંભીર હિતાશા, ઓ.સી.ડી. અથવા એવા રોગીઓ કે જેમને દવાઓ અને ઈસીટીથી ખાસ રાહિત ન હોય એમના માટે કેટલીક શાસ્ત્રકીયાઓ શક્ય છે. હાલમાં એનો ઉપયોગ ખૂબજ મર્યાદીત ધોરણ પર થાય છે.

ડીપ બ્રેઇન સ્ટીજ્યુલેશન (ડીબીએસ) કે જેમાં મગજના ઉઠાણામાં ઉતેજના પેદા કરવામાં આવે એ એક નવી પદ્ધતિ છે અને હજુ પ્રયોગાત્મક ધોરણો છે. જે ઘણી આશાસ્પદ જણાય છે.

પ્રશ્ન-૧૮

રીપીટીટીવ ટ્રાન્સકેનીયલ મેગ્નેટોિક સ્ટીમ્યુલેશન (આ.ટી.એમ.એસ.) એટલે શું ?

ઉત્તર-૧૮

આ પદ્ધતિમાં માથા પર અમૃક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉભુ કરીને મગજના અમક કોષોને ઉતેજીત કરવામાં આવે છે. હાલમાં એ હિતાશાના દરદીઓ માટે વપરાય છે પણ બીજા મનોરોગો માટેના એના વપરાશની શક્યતા માટેનું સંશોધન ચાલુ છે.

પ્રશ્ન-૧૯

માનસોપચાર (સાઈકોથેરાપી) શું છે ? તેમજ કોગનીટીવ બિહેવીઅરથેરાપી (સી.બી.ટી.) એટલે શું ?

ઉત્તર-૧૯

સાઈકોથેરાપીને લોકભાષામાં “વાતચીતથી સારવાર” કહી શકાય, એમાં માનસિક સારવાર માટે અમૃક માનસશાસ્ત્રીય સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. એ અનુભવી પદવીધારી નિષ્ણાત પાસેજ કરાવવી જોઈએ અને બધા જ માનસિક રોગો માટેનો એ ઈલાજ નથી.

સી.બી.ટી. પણ થેરેપીનોજ એક પ્રકાર છે જેમાં વિચાર અન વર્તન વિષેના માનસશાસ્ત્રતા સિદ્ધાંતો વાપરવામાં આવે છે.

પ્રશ્ન-૨૦

હીનોસીસનો ઉપયોગ શું દરેક માનસિક બીમારીના ઈલાજ માટે કરી શકાય ?

ઉત્તર-૨૦

હીનોસીસ બધા માનસિક રોગોનો ઈલાજ છે એ એક અત્યંત ભૂલ ભરેલી માન્યતા છે. હીનોસીસ પણ મનોચિકિત્સાનો જ એક પ્રકાર છે પણ બધા માનસિક રોગોની સારવાર એનાથી થઈ શકે નહિં.

પ્રશ્ન-૨૧

હું ઇન્ટરનેટ પર તમે જે દવા મને આપી છે એના વિશે વાંચતો હતો. ડોક્ટર, મને નથી લાગતું કે એ મને લાગ્યુ પડે.

ઉત્તર-૨૧

ઇન્ટરનેટ માહિતીનો અખૂટ ખજાનો છે પણ એની માહિતી સાચી અને સંદિગ્ય બંને હોય છે. જે ઘણીવાર ગોરમાર્ગ દોરનાર હોય છે. ઇન્ટરનેટ મનોચિકિત્સકનો પર્યાય કર્યારે પણ બની શકે નહિં.